

વર્લ્ડ 'સ
સ્ટ્રોન્ગેસ્ટ એન્ડ
હર્ષેસ્ટ ક્યુઆલિટી
નાતુર્ણ
એન્ટિઓક્સિડન્ટ

Natural **Astaxanthin** Powerful Antioxidant


કેરોટીનોઇડ્સનો રાજા

એન્ટિઓક્સિડન્ટ્સ માનવસર્જિત અથવા કુદરતી પદાર્થો છે જે અટકાવી શકે છે અથવા

સેલના અમુક પ્રકારના નુકસાનને વિલંબિતે પરમાણુઓ છે જે આપણા શરીરમાં મુક્ત રેડિકલ્સ સામે લડે છે. ફ્રી રેડિકલ્સ એ સંયોજનો છે જે નુકસાન પહોંચાડે છે જો તેમના આપણા શરીરમાં સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે. શું એન્ટિઓક્સિડન્ટ્સ રોગનિવારણ માટે મદદરૂપ થાય છે? એન્ટિઓક્સિડન્ટો જેમ કે વિટામિન સી અને ઇ, કેરોટિન, લાઇકોપીન, લ્યુટિન અને અન્ય ઘણા પદાર્થો કેન્સર, કાર્ડિયોવાસ્ક્યુલર જેવા રોગોને રોકવામાં મદદ કરવામાં ભૂમિકા ભજવી શકે છે રોગો. મનુષ્યમાં ઘણા મૂળભૂત સંશોધન અભ્યાસો અને નિરીક્ષણાત્મક રોગચાળાના અભ્યાસો સૂચવે છે કે એન્ટિઓક્સિડન્ટો ઓક્સિડેટીવ નુકસાનને અટકાવી શકે છે તે વ્યક્તિઓમાં કે જેઓ મોટા પ્રમાણમાં ફળો અને શાકભાજીનું સેવન કરે છે ઓક્સિડેટીવ નુકસાનને કારણે થતા રોગોના નીચા દરનો અનુભવ થતો હોય તેવું લાગે છે.

એસ્ટાક્સાન્ટિન તે કુદરતી રીતે જોવા મળતું કેરોટીનોઇડ રંગદ્રવ્ય છે જે ઘણા પ્રકારના દરિયાઈ જીવન, પ્રાણીઓ, ફળો, શેવાળ અને શાકભાજીમાં જોવા મળે છે. તે જંગલી સા ભોન અને કસ્ટેસિયનના ગુલાબી-લાલ રંગદ્રવ્ય માટે જવાબદાર છે જેમ કે ઝીંગા અને લોબસ્ટર્સ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે બીટા કેરોટીન અને લાઇકોપીન કરતા 10થી 100 ગણું વધારે શક્તિશાળી છે. વિટામિન ઇ, સી, ડી, બીટા-કેરોટિન અને સેલેનિયમ જેવા અન્ય એન્ટિઓક્સિડન્ટ્સથી વિપરીત, તે શરીરમાં પ્રોઓક્સિડન્ટ બનતું નથી. હીમાટોકોક્સ પ્લુવાયાલિસ જળચર શેવાળ તેની છે ઘટક પોતાને તણાવપૂર્ણ રીતે બચાવવા માટે એસ્ટાક્સાન્ટિન બનાવે છે પર્યાવરણીય પરિસ્થિતિઓ. તે શક્તિશાળી ડીએનએ રિપેરિંગ સક્રિય બનાવે છે. જ્યારે મુક્ત રેડિકલ્સને દૂર કરવાની વાત આવે છે ત્યારે એસ્ટાક્સાન્ટિન એક પાવરહાઉસ છે. તે વિટામિન સી કરતા 6,000 ગણું વધારે મજબૂત છે, વિટામિન કરતા 550 ગણું વધારે મજબૂત છે. ઇ, કોક્સુ 10 કરતા 800 ગણો મજબૂત અને કેટેચિન્સ કરતા 500 ગણો મજબૂત છે.

અષ્ટક્ષણથી 28222200નું ઓઆરએસી મૂલ્ય ધરાવે છે, જે તેને 293એક્સએ શક્તિશાળી બનાવે છે કારણ કે જંગલી બ્લુબેરી એક જાણીતો એન્ટિઓક્સિડન્ટ-સમૃદ્ધ ખોરાક છે અનોખું રસાયણ એસ્ટાક્સાન્ટિનમાં કોષ પટલને વિસ્તૃત કરતી રચના આરોગ્ય લાભોની આકર્ષક અને વૈવિધ્યસભર શ્રેણીને જન્મ આપે છે.



એસ્ટાક્સાન્ટિનના લાભો

- એન્ટિઓક્સિડન્ટ
- એન્ટી-એજિંગ
- ઊર્જા બુસ્ટ
- ત્વચાને ચમકદાર રાખે છે
- હૃદયના આરોગ્યને ટેકો આપે છે
- બળતરાને દબાવે છે
- પુરુષની પ્રજનનક્ષમતાને ટેકો આપે છે
- કેન્સરગ્રસ્ત કોશિકાઓના વિકાસને ઘટાડે છે
- ના ચિહ્નો ઘટાડી શકે છે આ ૬ ૯ ૬
- અલ્ઝાઇમર રોગને અટકાવે છે
- જ્ઞાનાત્મક આરોગ્યને ટેકો આપે છે



ઘટકો

- ✓ કુદરતી એસ્ટાક્સાન્ટિન
- ✓ હીમેટોકોક્સ પ્લુવીઆલિસ માઇક્રોએલો માંથી

માત્રા: દરરોજ ૧ સોફ્ટજેલ અથવા મેડિકલ પ્રોક્લિશનરની સલાહ મુજબ

તે કેવી રીતે કાર્ય કરે છે:

બેસ્ટ સુપ્પલેમેન્ટ અષ્ટક્ષણથી શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને તાણ દૂર કરનાર, બળતરા વિરોધી અને રોગપ્રતિકારક તંત્ર બૂસ્ટર તરીકે મદદ કરશે તેની અતુલ્ય સાથે એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો, અમારું ઉત્પાદન કેટલાક દીર્ઘકાલીન રોગોથી બચાવશે, ત્વચાને વિપરીત કરશે વૃદ્ધત્વ, વગેરે.

Disclaimer: These statements have not been evaluated by the Food and Drug Administration. This product is not intended to diagnose, treat, cure, or prevent any disease.

